

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૨/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૦/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૭ કેસ કરી, ૪૩ વ્યક્તિઓને ઝડપી, ૫૫ લીટર દેશી દારૂ, ૦૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ, ૦૪ બીયરટીન અને ૦૧ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨,૩૯૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૧૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૪૧૨/૧૭

કાઇમબ્રાન્ચ : તારાચંદ રાવતાજી પુરોહીત (રહે,દિવ્યજીવન રેસીડેન્સી, ન્યુ સી.જી.રોડ, ચાંદખેડા) એ તા.૨૬/૨/૧૭ નારોજ કાઇમબ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૬/૨૦૧૬ બપોરના ૪/૦૦ વાગ્યા થી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી (૧) એમ.એસ.સ્ટ્રીંગ એન્ડ્રપ્રાઇઝ નામની કંપનીના SBA બેંક શાખા પાદરીબજાર, ગોરખપુર ઉ.પ્ર.ના બેંક એકાઉન્ટ નં.૩૫૫૩૩૭૮૭૫૮૧ ના ધારક (૨) સુમન મજુમદાર, HDFC બેંક શાખા બેલગોરીયા, કોલકત્તાના બેંક એકાઉન્ટ નં.૫૦૧૦૦૧૪૯૭૦૩૮૭૦ ના ધારક તથા બંને બેંક એકાઉન્ટોને ઓપરેટ કરનાર તથા મો.નં.૯૫૩૭૫૫૭૭૭૭ નું સીમકાર્ડ કલોલથી ઈસ્યુ કરાવી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરનાર તથા મો.નં. ૭૯૯૮૦૯૬૮૮૦ નો ઉપયોગ કરનાર ધારક ભેગામળી તારાચંદના નામના તથા કંપનીના બનાવટી દસ્તાવેજો આધારે કલોલ ખાતેના વોડાફોન સ્ટોરમાંથી તારાચંદના ચાલુ મોબાઇલ નંબર ૯૫૩૭૫૫૭૭૭૭ નું જ સીમકાર્ડ મેળવી લઈ, તારાચંદની કંપનીના બેંક એકાઉન્ટની યુક્તિ-પ્રયુક્તિથી માહિતી મેળવી લઈ, ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી તે ટ્રાન્જેક્શનના OTP બદલાવેલ મોબાઇલ નંબર પર મેળવી, તે OTP મો.નં.૭૯૯૮૦૯૬૮૮૦ પર મોકલી તે આધારે કુલ-૨ ONLINE NEFT થી ટ્રાન્જેક્શન કરી ઉપર જણાવેલ બે બેંક એકાઉન્ટોમાં તારાચંદની કંપનીના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૭,૫૦,૦૦૦/- ટ્રાન્સફર કરી ઉચાપત કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.એસ.ગોડમ ચલાવે છે.

**ઘાટલોડીયા :** શૈલેષભાઈ હિરાલાલ શાહ (ઉ.વ.૬૫)(રહે,કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ-૧ સોલા રોડ ઘાટલોડીયા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આજથી બે માસ અગાઉથી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી ચિંતન પટેલ (રહે,વડોદરા) એ શૈલેષભાઈનાં દિકરા પ્રતિક શાહને કેનેડાના વર્ક વિઝા અપાવવાનું કહી, વિશ્વાસમાં લઈ, તેના બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ પેટે રૂપિયા ૬૦,૦૦૦/- જમા કરાવડાવી વર્ક વિઝા નહીં અપાવી તેમજ પૈસા પરત નહીં કરી, શૈલેષભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા ચલાવે છે.

**ઘરફોડ:-**

**સમાચાર યાદી નં.૪૧૩/૧૭**

**ગાયકવાડ હવેલી :** મોહમદતાહીર યાસીનભાઈ મનસુરી (રહે,હવેલી એપાર્ટમેન્ટ બીજા માળે ગાયકવાડ હવેલી રોડ જમાલપુર) એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૨/૧૭ સવારના ૧૦/૪૫ થી બપોરનાં ૪/૦૦ વાગ્યા દરમ્યાન પોતાનાં ઘરનાં દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૮૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.એ.રાઠવા ચલાવે છે.

**સાબરમતી :** કૃણાલભાઈ કિશોરભાઈ ત્રીવેદી (રહે,હરસિધ્ધી એપાર્ટમેન્ટ, હિરાજેન એપાર્ટમેન્ટ, રામનગર સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૨/૧૭ ના કલાક ૯/૦૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન કૃણાલભાઈનાં કાકાના દિકરા જતીનભાઈ (રહે,પારસીની ચાલી, સાબરમતી) નાં ઘરનાં દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, કબાટમાંથી રોકડા રૂપિયા ૬૦ થી ૬૫ હજાર તેમજ સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.છાસીયા ચલાવે છે.

**સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા :-**

**સમાચાર યાદી નં.૪૧૪/૧૭**

**ઓઢવ :** મંજુલાબહેન વા/ઓ નરસિંહભાઈ ગજ્જર (ઉ.વ.૬૬)(રહે,હરભોળાનાથ પાર્ક રામરાજ્ય નગર પાસે નેશનલ હાઇવે નં-૮ રામોલ) તા.૨૬/૨/૧૭ સાંજના ૭/૪૫ વાગ્યાના સુમારે ઓઢવ સોનીની ચાલીથી વિરાટનગર તરફ જતાં મેઇન રોડ, જતીન ફર્નિચર સામે રોડ ઉપરથી પસાર થતાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષ આશરનાં) મંજુલાબહેનનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી તોડી લઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ મંજુલાબહેન ગજ્જરે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દિનેશભાઈ હરજીભાઈ ચલાવે છે.

**રામોલ :** અંજીમાબહેન વા/ઓ રાજેશભાઈ બાજપાઈ (ઉ.વ.૪૨)(રહે,આલોક-૪ રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં વસ્ત્રાલ) તા.૨૩/૨/૧૭ બપોરના ૪/૦૦ વાગ્યાના સુમારે વસ્ત્રાલ નીરાત ચોકડી કંકુબા પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપરથી પસાર થતાં હતા દરમ્યાન એક અજાણ્યો પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષ આશરનો) અંજીમાબહેનનાં ગળામાંથી સોનાની પેંડલ સાથેની ચેઇન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેંચી તોડી લઈ ગયો હતો. આ અંગેની ફરીયાદ અંજીમાબહેન બાજપાઈ એ તા.૨૬/૨/૧૭ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

ગુજરાત યુનિવર્સિટી : હેમાબહેન વા/ઓ રોનકભાઈ શાહ (ઉ.વ.૪૭)(રહે,શાંન્તા સાગર ટાવર, દર્પણ છ રસ્તા પાસે, મેમનગર) ને માનસિક ડિપ્રેશનની બિમારી હોઈ તા.૨૬/૨/૧૭ બપોરના ૨/૪૫ વાગ્યા નાં સુમારે પોતાના ઘરે નવમા માળેથી પોતાની જાતે નીચે પડતુ મુકતાં, હેમાબહેનને માથામાં તેમજ બંને હાથે અને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.ચૌહાણ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.